



اہم نوٹ: اہیوے Check list بطور guideline اپو ما اوی چھے ،  
موجودہ حالات ما حکومت نا Rules & Regulations مطابق تمام عملو  
کرو واسطے ادبا التماس چھے .

شہر اللہ المعظم ۱۴۴۱ھ


## ما ہر مؤمن نو Daily Timetable

رقم وقت	عمل	تھی گیو؟
۱	سحور می نو وقت تمام تھاوانا ۱ سی ۵.۰ کلاک پہلا انھی جاو	
۲	سحور می تمکن سی کروو، وقت نو خیال مراکھو انے hydration نو خیال مراکھو، دواء لیوانی ہوئی تو یاد مراکھی نے لیوو، ایم خیال مراکھو کہ دواء نو سواد منہ ما یا حلق ما رہی نرجائی	ہاں
۳	سحور می کیدا بعد داتن کروو	
۴	صلوۃ اللیل نر پڑھی ہوئی تو کم انر کم شفع وترو فی نماز اداء پڑھو، امکان ہوئی تو گھر ما ثناء فی تلاوۃ کروو، یا ثناء فی audio لگاو	
۵	فجر نو وقت تھائی وھانہ لگ القران المجید فی تجویداً تلاوۃ سنو	
۶	فجر نو وقت تھائی تو بلند او انر سی اذان دیوو، انے سنہ پڑھو	
۷	گھر ما امامہ سی نماز پڑھو (طہارۃ نا جملہ امور انے نماز می نا کڑا ما اعتناء کروو)	
۸	فجر فی نماز نا بعد تسیح فاطمہؑ آکروو، تر قبل نہج مطابق نداء کروو کہ: اپن سگلا تسیح فاطمہ تمکن سی کریئے	
۹	تسیح فاطمہؑ آکیدا پچھی ماتم کروو	
۱۰	نماز نا بعد دعاؤنی تلاوۃ کروو، مولانا الامام علی زین العابدینؑ فی دعاء مبارک فی تلاوۃ کروو، یا audio سنو	ہاں
۱۱	تاریخ مطابق روزہ فی نیت لیوو	
۱۲	گھر نا لوگو نا ساتھ دوری شاکلہ پر قران فی تلاوۃ کروو، یا قران مجید فی audio سنو	
۱۳	ادنوما مولانا المنعم طع یر جبر دعاء نا نسخۃ عنایہ فرمایا چھے۔ یر مطابق دعاؤنی تلاوۃ	
۱۴	حفظ القران نو عمل کروو	
۱۵	موضع ما online سبق تھاتا ہوئی تو اھما شامل تھاوو	
۱۶	ITS طرف سی کوئی instruction آیا ہوئی۔ یر ہر روزہ online check کروو	



اہم نوٹ: اہیوے Check list بطور guideline اپوا ما اوی چھے ،  
موجودہ حالات ما حکومت نا Rules & Regulations مطابق تمام عملو  
کرو واسطے ادبا التماس چھے .

۱۷	نروال نو وقت تھائی تو بلند اولنر سی اذان دیوو	
۱۸	اول وقت ما گھر ما امامت سی نماز اداء کروو	
۱۹	هر فریضہ فی نماز نا بعد تسیح فاطمہ آکروو ، تر قبل نہج مطابق نداء کروو کن: اپن سگلا تسیح فاطمہ تمکن سی کرئے	
۲۰	تسیح فاطمہ کیدا پچھی ماتم کروو	
۲۱	ظہر فی نافلہ نا پچھی - شہر اللہ المعظم ما دسکا مطابق جہر دعاء فی تلاوہ تھائی چھے - یر دعاؤ فی تلاوہ کروو ، یا audio سنوو	بجائے
۲۲	فریضہ نا ساتھ سنہ انے نافلہ فی نماز مواظبہ سی اداء کروو	
۲۳	جمعة نا دن دعوت ہادیہ فی نہج مطابق قرضا حسنا عرض کروو ، بالخصوص - شہر اللہ المعظم ما اعمال مضاعفہ تھائی چھے - یر نیہ سی فاخر رقم عرض کروو	
۲۴	ITS52.com پر الداعی الاجل سیدنا محمد برہان الدین رضی نا - یا حار ہمدان - نا ۳ منٹ نا کلمات نورانیہ سنوو	
۲۵	دائرة العقیق طرف سی مؤمنات بہنونا online برامج تھاسے - اہما شامل تھاوو	
۲۶	وضوء کری نے online مجلس انے نماز واسطے تیار تھاوو	
۲۷	تلاوہ القرآن الکریم انے بیان فی online مجلس (هر روز تقریباً ۴۵ منٹ) ما ادب نا ساتھ شامل تھاوو	
۲۸	انتظار الصلوہ نا وقت ما یا عشاء فی نماز نا بعد فرزندوسی الامام الحسین ع انا شہادہ فی تلاوہ کروو	قبل العزب
۲۹	بٹیراؤ نے افطار ما چانے نماز نا بعد تیار نا جن پکاوا فی تیار ہی مجلس نا وقت نا پہلا ، تمام کری لیوو	





## اهم نوٹ: ابيوے Check list بطور guideline اپو ما اوي چھے ، موجوده حالات ما حکومت نا Rules & Regulations مطابق تمام عملو کرو واسطے ادبا التماس چھے .

مغرب نو وقت تھائی تو بلند اول نرسي اذان ديوو	۳۰
مغرب ني نماز گھر ما امامة سي پڑھوو	۳۱
"يا معطي السؤالات" ني دعاء پڑھي نے افطار کروو	۳۲
مولانا المنعم طعني خوشي مطابق خاک شفاء ، کھجور ، بسکٹ ، چاء انے دودھ پرے افطار کروو	۳۳
افطار بعد امکان مطابق گھر ما بخور کروو	۳۴
هر فريضة ني نماز نا بعد تسيح فاطمة ع آکروو ، تر قبل نهج مطابق نداء کروو کز: اپن سگلا تسيح فاطمة تمکن سي کرپے	۳۵
تسيح فاطمة ع آکيدا پچھي ماتم کروو	۳۶
مناجاة شريفة ني تلاوة کروو	۳۷
سنه انے نافله پڑھوو	۳۸
مغرب انے عشاء ني نماز نا بعد التسيح الاعظم ني نماز پڑھوو	۳۹
مغرب ني اذان سي ايک کلاک نا اندر ني نماز نو تھال گھر ما موکائي جائی ایم خيال مراکھوو	۴۰
جنم ني ۲ آداب نو خيال مراکھوو ، تھال پرسا تھے بيٹھي نے تمکن سي جنم تناول کروو	۴۱
صلوات ني جبر چنھي موکلوا ما اوي چھے۔ يير پڑھوو	۴۲
مولانا المنعم طعني نا حق ما طول العمر ني دعاء کروو ، نيماز ني خدمه کرنا واسطے خير ني جزاء ني دعاء کروو	۴۳
جنم نا پچھي فيميلي نا تمام افراد سا تھے بيٹھي نے خوش گفتگو کروو ، اولياء الله ع آني شانات انے سيد نا داعي الاجل طعني ني نعمتوني انے شانات ني ذکر کروو	۴۴
ماتم ني online مجلس ما ادب نا سا تھے 9:00 PM شامل تھوو	۴۵
بيهوري ني نماز پڑھوو	۴۶





અહમ નોટ: આ બેવે checklist બતૌર guideline આપવામા આવે છે, મૌજૂદા હાલાતમા હુકૂમતના Rules & Regulations મુતાબિક તમામ અમલો કરવા વાસ્તે અદબન ઇલ્તેમાસ છે.

## શેહરૂદાહિલ મુઅઝઝઅમ હી. ૧૪૪૧મા હર મુમિનનુ ટાઈમ ટેબલ

રકમ	વકત	અમલ	થઈ ગયું?
૧	સિહોરી	સિહોરીની વકત તમામ થાવાના ૧ થી ૧.૩૦ કલાક પેહલા ઉઠી જવુ.	
૨		સિહોરી તમકકુનસી કરવુ, વકતનો ખયાલ રાખવુ અને Hydration નો ખયાલ રાખવો, દવા લેવાની હોય તો યાદ રાખીને લેવુ એમ ખયાલ રાખવુ કે દવાનો સ્વાદ મુંહમા યા હલકમા રહી ના જાય.	
૩		સિહોરી કીધા બાદ દાતન કરવુ	
૪		સલાતુલ્લૈલ ન પઢી હોય તો કમ-અઝ-કમ શફાઅ વતરની નમાઝ અદા પઢવુ, ઇમ્કાન હોય તો ઘરમા સનાની તિલાવત કરવુ યા સનાની audio લગાવવુ.	
૫		ફજરનો વકત થાય વહાં લગ કુર્આન મજીદની તજવીદન તિલાવત સુનવુ	
૬	ફજર	ફજરનો વકત થાય તો બલંદ આવાઝસી અઝાન દેવુ અને સુન્નત પઢવુ	
૭		ઘરમા ઇમામતસી નમાઝ પઢવુ (તહારતના જુમ્લા ઉમૂર અને નમાઝીના કપડામા એઅતેના કરવુ)	
૮		ફજરની નમાઝના બાદ તસ્બીહે ફાતેમા અ.સ. કરવુ, તે કબ્લ નહુજ મુતાબિક નિદા કરવુ કે “અપન સગલા તમકકુનસી તસ્બીહે ફાતેમા કરીએ”	
૯		તસ્બીહે ફાતેમા કીધા બાદ માતમ કરવુ	
૧૦		નમાઝના બાદ દોઆઓની તિલાવત કરવુ, મૌલાનલ ઇમામ અલી ઝૈનુલ આબેદીન અ.સ.ની દોઆ મુબારકની તિલાવત કરવુ, યા audio સુનવુ.	
૧૧		તારીખ મુતાબિક રોઝાની નીયત લેવુ.	
૧૨		ઘરના લોગોના સાથે દૌરની શાકેલત પર કુર્આનની તિલાવત કરવુ, યા કુર્આનની audio સુનવુ.	
૧૩		આ દિનોમા મૌલાનલ મિન્આમ ત.ઉ.શ યે જે દોઆના નુસ્ખા ઇનાયત ફરમાયા છે યે મુતાબિક દોઆઓની તિલાવત,	
૧૪		હિફઝુલ કુર્આનનુ અમલ કરવુ	
૧૫		મૌઝેઅમા online સબક થાતા હોય, તો એહમા શામિલ થાવુ.	
૧૬	ITS તરફસી કોઈ instruction આયા હોય યે હરરોઝ online ચેક કરવુ		



**અહમ નોટ:** આ બેવે checklist બતૌર guideline આપવામા આવે છે, મૌજૂદા હાલાતમા હુકૂમતના Rules & Regulations મુતાબિક તમામ અમલો કરવા વાસ્તે અદબન ઇલ્તેમાસ છે.

૧૭	<b>ઝવાલ</b>	ઝવાલનો વકત થાય તો બલંદ આવાઝસી અઝાન દેવુ	
૧૮		અવ્વલ વકતમા ઘરમા ઇમામતસી નમાઝ અદા કરવુ	
૧૯		હર ફરીઝતની નમાઝના બાદ તસ્બીહે ફાતેમા કરવુ, તે કબ્લ નહજ મુતાબિક નિદા કરવુ કે “અપન સગલા તમકકુનસી તસ્બીહે ફાતેમા કરીએ”	
૨૦		તસ્બીહે ફાતેમા કીધા બાદ માતમ કરવુ	
૨૧		ઝોહરની નાફેલતના પછી શેહરૂલાહિલ મુઅઝઝઅમમા દસકા મુતાબિક જે દોઆની તિલાવત થાય છે. યે દોઆ મુબારકની તિલાવત કરવુ, યા audio સુનવુ.	
૨૨		ફરીઝતના સાથે સુન્નત અને નાફેલતની નમાઝ મુવાઝબતસી અદા કરવુ	
૨૩		જુમોઆના દિન દાઅવત હાદિયાની નહજ મુતાબિક કરઝન હસનાહ અરઝ કરવુ, બિલખુસૂસ શેહરૂલાહિલ મુઅઝઝઅમમા આઅમાલ મુદાઅફા થાય છે યે નીયતસી ફાબિર રકમ અરઝ કરવુ	
૨૪		its52.com પર અદાઈલ અજલ સૈયેદના મુહમ્મદ બુરહાનુદ્દીન રિ.અ.ના “યા હારે હમદાન”ના ત્રીન મિનીટના કલેમાત નુરાનિયાહ સુનવુ	
૨૫		દાઅરેતુલ અકીક તરફસી મુમેનાત બેહનોના online બરનામજ થાસે એહમા શામિલ થાવુ	
૨૬		<b>કબ્લ મગરિબ</b>	વુઝુ કરીને online મજલિસ અને નમાઝ વાસ્તે તૈયાર રેહવુ
૨૭	તિલાવતુલ ફુર્આનિલ કરીમ અને બયાનની online મજલિસ (હરરોઝ તકરીબન ૪૫ મિનીટ) મા અદબના સાથે શામિલ થાવુ		
૨૮	ઈતઝારુસ્સલાતના વકતમા યા ઇશાની નમાઝના બાદ ફરઝંદોસી અલ ઇમામિલ હુસૈન અ.સ.ના શહાદતની તિલાવત કરાવવુ		
૨૯	બઈરાઓને ઇફતારમા યા અને નમાઝના બાદ નિયાઝના જમન પકાવવાની તૈયારી મજલિસના વકતના પેહલા જ તમામ કરી લેવુ.		





**અહમ નોટ:** આ બેવે checklist બતૌર guideline આપવામા આવે છે, મૌજૂદા હાલાતમા હુકૂમતના Rules & Regulations મુતાબિક તમામ અમલો કરવા વાસ્તે અદબન ઈલ્તેમાસ છે.

૩૦	<b>મગરિબ</b>	મગરિબનો વકત થાય તો બલંદ આવાઝસી અઝાન દેવુ	
૩૧		મગરિબની નમાઝ ઘરમા ઇમામતસી પઢવુ	
૩૨		“યા મૌઅતીયુરસુઆલાત”ની દોઆ પઢીને ઇફતાર કરવુ	
૩૩		મૌલાનલ મિન્આમ ત.ઉ.શ.ની ખુશી મુતાબિક ખાકે શિક્ષા, ખજુર, બિસ્કીટ, ચા અને દુધ પર જ ઇફતાર કરવુ	
૩૪		ઇફતાર બાદ ઇમ્કાન મુતાબિક ઘરમા બુખુર કરવુ	
૩૫		હર ફરીઝતની નમાઝના બાદ તસ્બીહે ફાતેમા અ.સ. કરવુ, તે કબ્લ નહજ મુતાબિક નિદા કરવુ કે “અપન સગલા તમકકુનસી તસ્બીહે ફાતેમા કરીએ”	
૩૬		તસ્બીહે ફાતેમા કીધા બાદ માતમ કરવુ	
૩૭		મુનાજાત શરીફાની તિલાવત કરવુ	
૩૮		સુન્નત અને નાફેલત પઢવુ	
૩૯		મગરિબ અને ઇશાની નમાઝના બાદ અત્તસ્બીહુલ આઅઝમની નમાઝ પઢવ	
૪૦		મગરિબની અઝાનસી એક કલાકના અંદર નિયાઝનો થાલ ઘરમા મુકાય જાય એમ ખયાલ રાખવુ	
૪૧		જમનની ૧૨ આદાબનો ખયાલ રાખવુ, થાલ પર સાથે બેઠીને તમકકુનસી જમન તનાવુલ કરવુ	
૪૨		સલવાતની જે ચિઢ્ઠી મુકવામા આવી છે યે પઢવુ	
૪૩		મૌલાનલ મિન્આમ ત.ઉ.શ.ના હકમા તુલૂલ ઉમ્રની દોઆ કરવુ, નિયાઝના ખિદમત કરનાર વાસ્તે ખૈરની જઝાની દોઆ કરવુ	
૪૪		<b>રાત</b>	જમનના પછી ફેમિલીના તમામ અફરાદ સાથે બેઠીને ખુશ ગૂફતગુ કરવુ, અવલિયાઉલાહ અ.સ.ની શાનાત અને સૈયેદના અદાઇલ અજલ ત.ઉ.શ.ની નેઅમતોની અને શાનાતની ઝિકર કરવુ
૪૫	માતમની online મજલિસમા અદબના સાથે 9.00 P.M. IST શામિલ થાવુ		
૪૬	બીહોરીની નમાઝ પઢવુ		

